

India's view on the Treaty on the Prohibition of Nuclear Weapons

January 22, 2021

ન્યુક્લિયર શસ્ત્રોનાં પ્રતિબંધ પરની સંધી પર ભારતનો દ્રષ્ટિકોણ જાન્યુઆરી 22, 2021

ભારત વૈશ્વિક, બિન-ભેદભાવપૂર્ણ અને ખરાઈ કરી શકાય તેવા ન્યુક્લિયર નિ:શસ્ત્રીકરણ તરફ ઊંચી પ્રાધાન્યતા રાખવાનું અને તેનાં તરફ કટિબદ્ધ રહેવાનું ચાલું રાખે છે.

જ્યાં સુધી ન્યુક્લિયર શસ્ત્રોનાં પ્રતિબંધ પરની સંધી (TPNW) ની બાબત છે, ભારતે TONW પરની વાટાઘાટોમાં ભાગ લીધો ન હતો અને સાતત્યપૂર્ણ રીતે એ બાબત સ્પષ્ટ કરી હતી કે ભારત આ સંધીમાં પક્ષ બનશે નહીં. ભારત તે સંધીને સમર્થન આપતો નથી, અને તેમાંથી ઉદ્ભવી શકતી કોઈપણ જવાબદારીઓથી બંધાયેલો નથી. ભારત માને છે કે આ સંધી પારંપરિક આંતરરાષ્ટ્રીય કાયદાનાં વિકાસને સમાવતી નથી કે તેમાં યોગદાન આપતી નથી તેમજ તે કોઈ નવા ધારાધોરણો કે નિયમો સ્થાપિત કરતી નથી.

ભારત ન્યુક્લિયર શસ્ત્ર મૂક્ત વિશ્વનાં ધ્યેય તરફ તેની કટિબદ્ધતાનું પુન:ઉચ્ચારણ કરે છે. ભારત માને છે કે આ ધ્યેય સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં અને નિ:શસ્ત્રીકરણ પરની કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલા “ન્યુક્લિયર નિ:શસ્ત્રીકરણ” શિર્ષક ધરાવતા ભારતનાં કાર્યકારી પત્રકમાં રેખાંકિત કર્યા અનુસારની વૈશ્વિક પ્રતિબદ્ધતા દ્વારા હાથ ધરવામાં આવતી ક્રમશઃ પ્રક્રિયા મારફત અને સંમત થયેલ વૈશ્વિક બિન-ભેદભાવપૂર્ણ બહુપક્ષીય ફેમવર્ક મારફત હાંસલ કરી શકાય છે. આ સંબંધમાં, સર્વસંમતિનાં આધાર પર કાર્ય કરતા વિશ્વનાં એકમાત્ર બહુપક્ષીય નિ:શસ્ત્રીકરણ વાટાઘાટોનાં મંચ એવા નિ:શસ્ત્રીકરણ પરની કોન્ફરન્સમાં વ્યાપક ન્યુક્લિયર શસ્ત્રોનાં સંમેલન પર વાટાઘાટોની શરૂઆત કરવાની બાબતને સમર્થન આપે છે. ન્યુક્લિયર શસ્ત્રોથી મૂક્ત વિશ્વનાં ધ્યેય તરફ કાર્ય કરવા ભારત સંયુક્ત રાષ્ટ્રનાં તમામ રબ્ય રાષ્ટ્રો સાથે કામ કરવા તૈયાર છે.

નવી દિલ્હી
જાન્યુઆરી 22, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.